




માનવ તંદુરસ્તી... ૪૮૨, આંતરડાઓ, અને પાચનક્ષિયા.







©ADAM

small intestine





©ADAM.



માનવ તંકુરસ્તી..(૧૦)..૪૬૨, આંતરડાઓ, અને પ્રાચનકિયા.

આ પોસ્ટ છે “માનવ તંકુરસ્તી --- ૪૬૨, આંતરડાઓ અને પ્રાચનકિયા” (STOMACH, INTESTINES & DIGESTIVE SYSTEM).

ભલે, મગજ માર્ગદર્શક હોય, ભલે, કદય અને ફેફસાચો દ્વારા “પોષણ” મળો....પણ, જો બહારનો આહાર, જેમાં શરીરને ટકાવવાના “તત્ત્વો” જો અંગોને મળી ના શકે તો એ સર્વ શું કામના ?.....તો, હવે, આ પોસ્ટ જે પ્રમાણે પ્રગાટ કરી તેની સાથે સહમત હશો.

હવે, ચાલો, આપણે પોસ્ટ સાથે પ્રગાટ કરેલા ડાયાગ્રામોને નિઝાળીએ.....થોડું સમજવા પ્રયાસ કરીએ....જેવી રીતે પ્રબુએ દેહમાં ગોઠવણી કરી છે તે સમજુએ.....તો, તમે આટલું જો કર્યું, તો તમોને “આભાર” !શા માટે આભાર ?

જઠર, આંતરડાઓ, અને પ્રાચંકિયા....(STOMACH, INTESTINES & the DIGESTIVE SYSTEM)..

(૧) ...જઠર (STOMACH)

જઠરથી શરૂઆત કરી કારણ કે ખાધેલો ખોરાક અહીં વધુ સમય માટે રહે છે ..અને, અહીં જે ખોરાકને એવું સ્વરૂપ અપાય કે એ “એવા તત્ત્વો” રૂપે લોહીમા પ્રવેશ કરી શકે. ફરી પોસ્ટ કરેલા ડાયાગ્રામો નિઝાળો.....ખોરાક મોઢામાં મુકાતા, તરત જ જીબ એને ફેરવે, અને દાંતો એને ચાવે, અને એની સાથે સાથે ગાલોમાંથી ઝરેલો પ્રવાહી તત્ત્વ, લાળ (SALIVA) એને પોચો કરે.....અને અંતે, એ પાછળના ભાગ તરફ લઈ જવામા આવે...યાને ફેરીન્કશ (PHARYNX) તરફ આવે....અહીં તમે નિઝાળો કે પ્રબુએ કેટલી સરસ રચના કરી છે કે એ ખોરાક ફેરીન્કશ અને શાસનલી તરફ ના જતા ફક્ત ફેરીન્કશમાંથી અન્જલીમાં (Esophagus) જ જાય...અને ત્યાંથી એ ખોરાક જઠરમાં પ્રવેશ કરે.એક વાર, ખોરાક જઠરમાં આવે એટલે એની અંદર એસીડ (ACID) ઝરે, અને સાથે સાથે, એનાઇમ (ENZYME) નામના તત્ત્વો ઝરી જઠરમા આવે....ખોરાક જે મુખ્યત્વે ત્રણ પ્રદાણો (CARBOHYDRATES, PROTEINS & FATS) થી બનેલો છે તે બધા તત્ત્વોની અસરે અને જઠરના ખોરાક આમતેમ ફેરવવાના કારણે “અંતીમ તત્ત્વો” (GLUCOSE, AMINO ACIDS & FATTY ACIDS) સ્વરૂપે બને.....અને, આ તત્ત્વો આંતરડાના અંદરના ભાગેથી નજીક પથરાયેલી નાની નાની લોહી-નળીઓમાં પ્રવેશ કરી, જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં પહોંચી શકે.

(૨) ...આંતરડાઓ, નાનું અને મોર્દું (SMALL INTESTINE & LARGE INTESTINE)

માનવ દેહમાં બે નામે આંતરડાઓ છે....એક નાનું (SMALL INTESTINE) અને બીજું મોટું (LARGE INTESTINE).

હવે, તમે ડાયાગ્રામો નિહાળો....જદર સાથે જોડાયેલું છે નાનું આંતરડું „અને જે ભાગો જોડાયેલું તેને ડિઓડોનમ (DUODENUM) કહેવાય....ત્યાર બાદના આંતરડાના ભાગને જરૂનમ (JEJUNUM) કહેવાય...અને અંતે મોટા ભાગના આંતરડાને ઈલીઅમ (ILEUM) કહેવાય....જે અંતે મોટા આંતરડા (LARGE INTESTINE or LARGE BOWEL) સાથે જોડાય જાય....એ આંતરડાનો અંત એટલે માનવ શરીરમાંથી મડરૂપી નકામનું તત્ત્વ (STOOLS) ને શરીર બહાર નિકળવા માટેનું દ્વાર (ANUS).જદર અને આંતરડાની શરૂઆત થાય ત્યાં એક સ્ફિંક્ટર (SPHINCTURE) હોવાના કારણે ખોરાક પાછો જદરમાં ના જઈ શકે. એક વાર ખોરાક આંતરડામાં પ્રવેશ કરે એટલે એ આંતરડામાં ગોલ-બ્લેડરનું બાઇલ (BILE from GALL BLADDER) તેમજ આંતરડામાંથી પેન્ક્રીયાસના એન્ઝાઈમો (PANCREATIC ENZYMES) તેમજ આંતરડામાંથી ઝરેલા એસીડની અસર દુર કરતા બાઇકાર્બોનેટ્સ (BICARBONATES), લેગા મળી ખોરકને “અંતીમ અવસ્થા”મા લાવે...જે થકી, ખોરાકના “પોષણ-રૂપી તત્ત્વો” લોહીમાં જઈ શરીરના અન્ય ભાગો જઈ શકે.

જ્યારે, મોટા આંતરડામાં જે કંઈ પ્રવેશ કરે ત્યારે એમાં પાણી અને પ્રાચન ના થઈ શકે એવો “ખોરાકનો તત્ત્વ” હોય છે....અહી ફક્ત જરૂરત પ્રમાણે પાણી શરીરમા લેવાય છે, અને વધારાનું પાણી અને તત્ત્વોનું બનેલું મદ (STOOL) શરીર બહાર આવે છે

આ રહી માનવ દેહની ખાંધેલા ખોરાકની યાત્રા.....મુખમાંથી પ્રવેશ મેળવતો ખોરક, અંતે શરીર બહાર આવે તે દરમ્યાન પ્રભુની રચના આધારીત કેટલી સુંદર વ્યવસ્થા સાથે “નવું સ્વરૂપ ” મેળવી, શરીર અંદર પ્રવેશ કરે એને આપણે “પ્રાચન-કીયા” નામ આપ્યું છે પણ ખરેખર તો એ એક “પ્રભુનો ચમત્કાર” જ છે....આ કિયાને હજુ તો આપણે માઇક્રોસ્કોપ (MICROSCOPE)થી નિહાળી નથી.....જ્યારે આપણે એ રીતે નિહાળીએ તો તો જરૂર આપણે કહી શકીએ ” પ્રભુ, મને આવી અદભુત માનવ કાચા આપી, તે માટે તને કોટી કોટી પ્રણામ !”